

A PLACE WHERE EVERY CHILD MATTERS



SHREE VASISHTHA VIDHYALAYA

GUJARATI MEDIUM | BILINGUAL MEDIUM | ENGLISH MEDIUM (GSEB)



परस्परं भावयन्तः

ભાગણીઓ
આપણા અસ્તિત્વનો
આધાર છે.



આનંદ



વસિષ્ઠ



JR. KG
(પુષ્પવાટિકા)



MONTHLY PLANNER

JULY



હર ઘર વસિષ્ઠ,
હર દિલ વસિષ્ઠ



AT & PO.: VAV, N.H.:48, TA.: KAMREJ, DI.: SURAT (394326) PH. NO.: 02621-255551/3 MO.: 91733 15555

વિષયાનુભૂતિ

વિષય	ગુજરાતી	ગણિત	અંગ્રેજી	
અભ્યાસક્રમ →	ક, ખ, ગ, ઘ મૂળાક્ષર પ્રવૃત્તિ	અંક ૧, ૨ (પ્રવૃત્તિ)	A, B આલ્ફાબેટ પ્રવૃત્તિ	1,2 નંબર્સ પ્રવૃત્તિ
શ્રવણાનુભૂતિ (સાંભળવાની ક્રિયા)	મૂળાક્ષર પરથી શરૂ થતાં જોડકણાં શિક્ષક ગાઈને બાળકને સંભળાવશે.	અંકોના જોડકણાં શિક્ષક ગાઈને બાળકને સંભળાવશે.	ચિત્ર દ્વારા આલ્ફાબેટનો ઉચ્ચાર શિક્ષક બોલીને બાળકને સંભળાવશે.	નંબર્સ પ્રમાણે શિક્ષક મણકાંની ગણતરી કરી બાળકને સંભળાવશે.
સ્પરાનુભૂતિ (બોલવાની ક્રિયા)	શિક્ષક જોડકણાં ગવડાવે તેમ બાળક ગાશે.	૧, ૨ અંકોના જોડકણાં સાંભળીને અંકોનો ઉચ્ચાર બાળક બોલશે.	ચિત્ર જોઈને આલ્ફાબેટનો ઉચ્ચાર બાળક સાંભળીને બોલશે.	મણકાંની ગણતરી દ્વારા નંબર્સનો ઉચ્ચાર સાંભળીને બાળક બોલશે.
દ્રશ્યાનુભૂતિ (ઓળખવાની ક્રિયા)	મૂળાક્ષર ઓળખી ચિત્ર પર ગોળ કરવાની પ્રવૃત્તિ.	અંકોને ઓળખી તેના જેવા અંકો સાથે જોડવાની પ્રવૃત્તિ.	રેતીમાં બાળકો આલ્ફાબેટનું લેખન કરવાની પ્રવૃત્તિ.	નંબર્સ મુજબ મણકાં પરોવવાની પ્રવૃત્તિ.
અક્ષરાનુભૂતિ (લખવાની ક્રિયા)	બાળક વર્કશીટમાં, બુકમાં અને નોટબુકમાં મૂળાક્ષરો ઘૂંટશે તેમજ રંગ પૂરશે.	બાળક વર્કશીટમાં, બુકમાં અને નોટબુકમાં અંકો ઘૂંટશે તેમજ રંગ પૂરશે.	બાળક વર્કશીટમાં, અને નોટબુકમાં આલ્ફાબેટ ઘૂંટશે તેમજ રંગ પૂરશે.	બાળક વર્કશીટમાં અને બુકમાં નંબર્સ ઘૂંટશે તેમજ રંગ પૂરશે.

પ્રશ્નાનુભૂતિ

Subject	Week	Matter
પ્રશ્ન	1 st to 4 th	પાણી ક્યાંથી આવે છે?

પ્રત્યક્ષાનુભૂતિ

Subject	Week	Matter
જીવન શિક્ષણ	1 st to 4 th	બટન બંધ કરવા
ઈન્દ્રિય શિક્ષણ	1 st to 4 th	બંગલાપેટીની રમત

વિસ્મયાનુભૂતિ

Subject	Week	Matter
પ્રયોગ/પ્રવૃત્તિ	1 st to 4 th	ચમકીલા સિક્કાઓ

“હંમેશા શ્રેષ્ઠ વસ્તુને જ તમારું લક્ષ્ય બનાવો.”

આનંદાનુભૂતિ

Subject	Week	Matter
Drawing (કલાનુભૂતિ)	1 st	સ્માઈલી (પેજ નં - ૧)
	2 nd	ગોળ (આકાર) (ડ્રોઈંગ બુક)
	3 rd	
	4 th	ઝિલ્લી (પેજ નં - ૨)
Activity (સર્જનાનુભૂતિ)	1 st	હથેળીની છાપ
	2 nd	
	3 rd	કલેમાંથી ગોળી વળાવવી
	4 th	
Game (રમતાનુભૂતિ)	1 st	દોડ
	2 nd	
	3 rd	પાસિંગ ઘ બોલ
	4 th	
General Knowledge (જ્ઞાનાનુભૂતિ)	1 st	આપણો પરિવાર
	2 nd	
	3 rd	
	4 th	
Action Song & Story (કલ્પનાનુભૂતિ)	1 st	જોડકણું - વાર્તા રે વાર્તા
	2 nd	જોડકણું - ગાય રે ગાય
	3 rd	વાર્તા - તરસ્યો કાગડો અભિનય ગીત - આવો મેઘરાજા
	4 th	
Dance (નૃત્યાનુભૂતિ)	1 st	Boom Boom Music (Basic Steps)
	2 nd	
	3 rd	
	4 th	
Music (સંગીતાનુભૂતિ)	1 st	પ્રાર્થના (મારા પ્રભુ તો નાના છે)
	2 nd	
	3 rd	જોડકણાં - પા ! પા ! પગલી, એક પાન બીજું પાન
	4 th	ડ્રમ વગાડવું
Skating (ગતિનાનુભૂતિ)	1 st	How to wear skating
	2 nd	How to Balance
	3 rd	How to Walk
	4 th	
Swimming (તરણાનુભૂતિ)	1 st	Basic exercise Kicking, Walking, Jumping
	2 nd	
	3 rd	
	4 th	

“જે કાર્ય આજે કરી શકો તે કાલ પર મુલતવી રાખો નહિ.”

કાર્યાનુભૂતિ

Subject	Week	Matter
ગુજરાતી	1 st to 4 th	ક, ખ, ગ, ઘ મૂળાક્ષર પ્રવૃત્તિ
ગણિત	1 st to 4 th	૧ અને ૨ અંકો પ્રવૃત્તિ
અંગ્રેજી	1 st to 4 th	A, B આલ્ફાબેટ, 1,2 નંબર્સ પ્રવૃત્તિ

સર્વાંગી વિકાસાનુભૂતિ

1	08-07-2025	Tuesday	રંગપૂરણી સ્પર્ધા
2	10-07-2025	Thursday	ગુરૂપૂર્ણિમાની ઉજવણી
3	-	-	મોનસૂન ડે

મૂલ્યાનુભૂતિ

1 st & 2 nd	હું દરરોજ માતા-પિતાને પગે લાગીશ.
3 rd & 4 th	હું મારી વસ્તુઓને યોગ્ય સ્થાને મૂકીશ.

ભાવાનુભૂતિ

આનંદદાયક પ્રવૃત્તિ

FIRST WEEK : PAINT YOUR HAPPINESS

આનંદની લાગણી માટે બાળકે શાળામાં મનગમતું ચિત્ર દોરી કે ચિત્રમાં રંગ પૂરી આનંદ વ્યક્ત કરવો.

THIRD WEEK : HAPPY MOMENT

બાળકને આનંદ આપતી હોય એવી એક્ટિવિટી ઘરે કરવાની રહેશે જેવી કે વૃક્ષારોપણ, ઘરના કામમાં મદદ, ગમતી રમત રમવી, ગમતી વસ્તુ બનાવવી, ગાયને રોટલી આપવી વગેરે.
(બાળકે પ્રવૃત્તિ કરતો ફોટો વોટ્સઅપ પર વર્ગ શિક્ષકને મોકલવો.)

SECOND WEEK : SMILEY BATCH

બાળકો ઘરે **Smiley Batch** બનાવશે અથવા બહારથી ખરીદશે અને **તા.11-07-2025** ના રોજ આ **Smiley Batch** લગાવીને શાળામાં આવશે.

FOURTH WEEK : HAPPY WALK

શાળાની પ્રવૃત્તિ :- બાલભવન થી ધો. 2 બાળકો શાળામાં વર્ગ શિક્ષક સાથે **Happy walk** કરશે.
ઘરની પ્રવૃત્તિ :- દરેક બાળકે ઘરે પરિવારના સભ્યો સાથે ગાર્ડનમાં સોસાયટીમાં કે ટેરેસ પર જ્યાં અનુકૂળતા હોય ત્યાં **Happy walk** કરશે.

HAPPINESS PLEDGE

બાળકે આ વાક્યો જુલાઈ મહિનામાં રોજ બોલવા અને આનંદમાં રહેવું.

- ◆ હું ખુશ રહેવાનું પસંદ કરું છું.
- ◆ આજનો દિવસ મારા માટે આનંદનો છે.
- ◆ મારા દિવસની શરૂઆત સ્મિતથી કરું છું.
- ◆ મારી ખુશી માટે હું જ જવાબદાર છું.
- ◆ હું હંમેશા આનંદમાં રહીશ અને અન્યને પણ આનંદમાં રાખીશ.



સર્જનાનુભૂતિ - ફોટો ગેલેરી



“આનંદની શરૂઆત 'શાંતિ' થી થાય છે અને આનંદની તીવ્રતા એ 'પરમાનંદ' છે.”

EDUCATING | EMPOWERING | ENRICHING | ENHANCING | EDIFYING | ENLIGHTENING